



SPRAYKING LIMITED

(Formerly known as Sprayking Agro Equipment Limited)

Manufacturer & Exporter of Brass Forged & Turn Components

Plot No.4009-10, G.I.D.C. Phase-III, Dared, Jamnagar – 361004 (Gujarat) INDIA

CIN No.: L29219GJ2005PLC045508 Website : www.spraykingagro.com

Email : csspraykingagro@gmail.com, spraykingagro@yahoo.com

May 29, 2024

To,
BSE Limited
P.J Towers, Dalal Street,
Fort, Mumbai - 400 001

Scrip Code: 540079

Dear Sir,

Sub: Newspaper Advertisement under Regulation 47 read with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

In compliance with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copy of Newspaper advertisement of the Audited Financial Results along with Statement of Assets & Liabilities for the quarter and year ending March 31, 2024 published in English newspaper “Financial Express” and Gujarati Newspaper “Financial Express”.

The said newspaper advertisement has also been uploaded on the website of the Company at

Thanking you.

FOR SPRAYKING LIMITED
(Formerly known as Sprayking Agro Equipment Limited)

Hitesh Pragajibhai Dudhagara
Managing Director
DIN: 00414604

Encl: As below

Kesar Petroproducts Limited

(CIN: L23209PN1990PL0054829)

Regd. Office: Office - D-7/11, MIDC Lote Parthuram, Taluka Khed, Ratnagiri-415722
Phone No. 02356-272339; Email Id: info@kesarpetroproducts.com; Website: www.kesarpetroproducts.com

Extract of audited Financial Results for the Quarter and Year Ended 31 March, 2024

Sr. No.	Particulars	For The Quarter Ended On			Year Ended	
		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from Operations	25	-	15	51	59
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(12)	(60)	(35)	(158)	(157)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(12)	(60)	(35)	(158)	(157)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(12)	(60)	(35)	(158)	(157)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-	-	-	-	-
6	Equity Share Capital	7,085	7,085	7,085	7,085	7,085
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	(5,529)
8	Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) -					
	1. Basic:	(0.00)	(0.08)	(0.00)	(0.02)	(0.02)
	2. Diluted:	(0.00)	(0.08)	(0.00)	(0.02)	(0.02)

Note:
1) The above financial results which are published in accordance with Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations) have been reviewed by the Audit Committee at a meeting held on 27th May, 2024 and approved by the Board of Directors at their meeting held on 27th May, 2024. The financial results are prepared in accordance with the Ind AS prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies.
2) The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015.
3) The figures of the previous periods (quarter/year) have been regrouped/rearranged/reclassified wherever considered necessary.

For and on behalf of the Board of Directors
For Shreyas Intermediates Limited Sd/-

Surya Prakash Pandey
Director
DIN : 1898839

Place : Mumbai
Date : 27th May, 2024

STERLING TOOLS LIMITED

CIN: L29222DL1979PLC009668

Regd. Office: Unit No. 515, DLF Tower A, Jasola District Centre, New Delhi-110025
Corporate Office: Plot No. 4, D L F Industrial Estate, Faridabad-121003
E-mail: csec@stfasteners.com, Website: www.stfasteners.com
Tel no.: 91 129 2270621-25 / Fax no.: 91 129 2277359

POSTAL BALLOT NOTICE

Notice is hereby given that pursuant to the provisions of Sections 110, 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013 (the "Act"), read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, General Circular No. 14/2020 dated April 08, 2020 and General Circular No. 17/2020 dated April 13, 2020 read with other relevant circulars, including General Circular No. 11/2022 dated December 28, 2022 and 09/2023 dated September 25, 2023 issued by the Ministry of Corporate Affairs, Government of India (the "MCA Circulars"), Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India ("SS-2"), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "SEBI LODR"), and any other applicable laws, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force), the Postal Ballot Notice dated 10th May, 2024 has been sent by e-mail on Tuesday, 28th May, 2024 to all those Members of Sterling Tools Limited (the "Company"), who have registered their e-mail addresses with the Company/ the Company's Registrar and Transfer Agent ("RTA"), MAS Services Ltd ("MAS") [in respect of shares held in physical form]/ Depositories Participants ("DP") [in respect of shares held in dematerialized form] and made available to the Company by the respective depositories as on the cut-off date i.e., Friday, 24th May, 2024 ("cut-off date"), for seeking approval from the Members for passing following resolutions through Postal Ballot by remote electronic voting ("remote e-voting") only:-

S. No.	Description of Resolution	Type of Resolution
1	Change in designation of Mr. Anil Aggarwal from Chairman cum Managing Director to Chairman and Whole Time Director of the Company	Special
2	Change in designation of Mr. Atul Aggarwal from Whole Time Director to Managing Director of the Company	Special
3	Appointment of Mr. Akhili Aggarwal (DIN: 01681666) as Whole-time Director of the Company and payment of remuneration thereof	Special
4	Appointment of Mr. Sanjiv Garg (DIN: 01681666) as Non-Executive Independent Director	Special

In compliance with Regulation 44 of the SEBI Listing Regulations and pursuant to the provisions of Sections 108 and 110 of the Act read with the Rules framed thereunder and the MCA Circulars, the requirement of sending physical copies of Postal Ballot Notice and Forms has been dispensed with. Accordingly, physical copies of Postal Ballot Notice, Postal Ballot Form and pre-paid business reply envelope have not been sent to any Member. Hence, the communication of assent or dissent of the Members would take place through remote e-voting system only. A copy of the Postal Ballot Notice is also placed on the Company's website at www.stfasteners.com; website of stock Exchanges i.e. National Stock Exchange of India Limited at https://www.nseindia.com/ and BSE Limited at https://www.bseindia.com/ and on the website of National Securities Depository Limited (NSDL) at https://evoting.nsdcl.com.

Remote E-Voting

The Company has engaged the services of NSDL to provide the platform facilitating the remote e-voting. Members may cast their votes remotely, on the dates mentioned here-in-below, using the e-voting platform of NSDL. The Board of Directors of the Company has appointed Mr. Santosh Kumar Pradhan, Practising Company Secretary (Membership No. FCS 6973 & Certificate of Practice No. 7647) as the Scrutinizer to conduct the Postal Ballot through remote e-voting process in a fair and transparent manner, in accordance with the Act, and the Rules made thereunder.

All the Members are hereby informed that:

- All the resolutions set out in the Postal Ballot Notice will be transacted through remote e-voting only.
- Remote e-voting shall commence from Thursday, 30th May 2024 from 9:00 A.M (IST) and ends on Friday, 28th June 2024 at 05:00 P.M.(IST);
- Remote e-voting shall be blocked after 5:00 P.M. on Friday, 28th June 2024 at 05:00 P.M.(IST) and no Member shall be allowed to cast vote through remote e-voting thereafter;
- A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories/NSDL as on the cut-off date, i.e., Friday, 24th May, 2024 only shall be entitled to avail the facility of remote e-voting;
- Once the vote on a resolution is cast by the Member, he/she shall not be allowed to change it subsequently or cast the vote again.
- The voting rights of members shall be in proportion to their share of the paid up equity share capital of the Company as on the cut-off date i.e., Friday, 24th May, 2024;
- A Person who is not a Member of the Company as on the cut-off date should treat this Postal Ballot Notice for information purpose only.
- The manner of remote e-voting by Members holding shares in dematerialized mode or physical mode or for Members who have not registered their email addresses is provided in the Postal Ballot Notice available on the websites of the Company, Stock Exchanges and NSDL. Additionally, in terms of SEBI Circular dated December 09, 2020, individual members holding shares in demat mode, can register directly with the depository or through their demat account, to access e-voting page of NSDL, without having to register again with NSDL for participating in the e-voting process. The detailed procedure in this regard has been explained in the Postal Ballot Notice.
- In case of any queries, you may refer to the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdcl.com or for any assistance before or during the e-voting can contact on toll free no.: 022-4886-7000 and 022-2499-7000 or send a request at evoting@nsdl.co.in and to our RTA at investor@masserv.com or call on 011-26387281-82-83,41320335.

KYC update

The Members holding shares in physical mode can register/update their e-mail ID, contact and other KYC details by submitting duly filled and signed Form ISR-1 along with self-attested copy of the PAN card and other relevant documents, as mandated by SEBI vide its circular dated March 16, 2023. The said form along with other requisite details is available on the website of Mas Services Limited, RTA at www.masserv.com. The duly filled form can be submitted in Person or through registered post to the RTA at T-34 2nd Floor, Okhla Industrial Area, Phase-II, New Delhi 110020 or through electronic Mode at investor@masserv.com. However, the Members holding shares of the company in electronic form can verify/update their email address and mobile number with their respective DP. In case, e-mail ID of a Member is already registered with the Company/RTA or the DP, login credentials for voting shall be sent on the respective Member's registered e-mail ID, along with the Postal Ballot Notice.

For Sterling Tools Limited Sd/-

Abhishek Chawla
Company Secretary & Compliance Officer
M. No. : A34399

Place: Faridabad
Date: 28-05-2024

RACE ECO CHAIN LIMITED

Registered Office: Shop No. 37, Shankar Market, New Delhi, Central Delhi-110001
Website: www.racechain.com, Email: contactus@racechain.com CIN NO. L37100DL1999PLC102506

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED ON 31ST MARCH, 2024

Particulars	Quarter Ended			Year Ended	
	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023
	Audited	Unaudited	Un-Audited	Audited	Audited
Total Revenue from operations	8,516.86	7,268.41	9,232.29	34,748.13	26,908.49
Net Profit / (Loss) for the year/period (before Exceptional items and Tax)	39.41	72.01	64.35	272.90	178.86
Net Profit / (Loss) for the year/period before tax (after Exceptional items)	39.41	72.01	64.35	272.90	178.86
Net Profit / (Loss) for the year/period after tax and Exceptional items	11.40	48.94	44.47	154.70	130.48
Total Comprehensive Income for the year/period [Comprising Profit / (Loss) for the year/period (after tax) and Other Comprehensive Income (after tax)]	20.57	48.94	44.47	163.87	130.32
Equity Share Capital	1,643.22	1,643.22	1,643.22	1,643.22	1,643.22
Other Equity	-	-	-	577.62	413.76
Earnings Per Share of Rs. 10/- each					
1. Basic (Rs.)	0.07	0.30	0.27	0.94	0.79
2. Diluted (Rs.)	0.07	0.30	0.27	0.94	0.79

Note: 1) The above is an extract of the detailed format of Consolidated and Standalone Financial result for Quarter and Year ended on 31st March, 2024 filed with stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the said results are available on the website of BSE & NSE at www.bseindia.com, www.nseindia.com as well as on the Company's website at www.racechain.com.
2) The Key information on Standalone Financial Results for Quarter and Year ended on 31st March, 2024 are given below:

Particulars	Quarter Ended			Year Ended	
	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023
	Audited	Unaudited	Un-Audited	Audited	Audited
Revenue	7,946.96	6,940.06	9,232.29	33,849.88	26,908.49
Profit before tax	44.92	53.02	64.35	270.10	178.86
Profit after tax	23.62	29.19	44.47	156.72	130.48

By order of the Board
For Race Eco Chain Limited Sd/-

Shiwati Gandhi
Company Secretary

Place: Sahibbad, UP
Date: 28/05/2024

SPRAYKING LIMITED

(Formerly Known as Sprayking Agro Equipment Limited)

Registered office: Plot No. 4009 & 4010, GIDC, Phase III, Dared Jamnagar-361004, Gujarat
Tel.: 0288-2730750; Fax: 0288-2730225, Website: <https://sprayking.co.in/>; Email: csspraykingagro@gmail.com

Extract of the Audited Financial Results (Standalone and Consolidated) for the Quarter/Year ended 31st March, 2024

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter ended			Year ended		
		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024
1	Total income from operations	749.93	240.73	793.45	3113.79	1932.77	10166.44
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	127.17	19.08	172.38	355.63	232.15	1242.89
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	127.17	19.08	172.38	355.63	232.15	1242.89
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	101.60	11.58	110.55	269.07	170.02	891.60
5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss for the period after tax) and Other Comprehensive Income (after tax)	101.60	11.58	110.55	269.07	170.02	891.60
6	Equity Share Capital	1056.79	1056.79	634.08	1056.79	634.08	1056.79
7	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -						
	1. Basic:	0.69	0.08	1.23	1.82	2.06	6.03
	2. Diluted:	0.69	0.08	1.23	1.82	2.06	6.03

Note:
1) These results have been prepared in accordance with the Indian Accounting Standards (referred to as "Ind AS") 34 interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rules as amended from time to time.
2) The above audited standalone financial results have been prepared in accordance with the recognition and measurement principles of the Companies Indian Accounting Standards ("Ind AS") as prescribed under Section 133 of the Companies Act, 2013, read with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended from time to time and other recognized accounting practices and policies to the extent applicable.
3) The figures for the quarters ended 31st March, 2024 and 31st March, 2023 are the balancing figures between audited figures in respect of the full financial year and year to date figures up to the third quarter of the relevant financial year.s which were subjected to limited review.
4) These audited standalone financial results of the Company for the quarter and year ended 31st March, 2024 have been reviewed by the Audit Committee and then approved by the Board of Directors at their respective meetings held on 28th May, 2024. The Statutory Auditors have issued an unmodified audit opinion on these standalone financial results.
5) Figures of the previous periods have been regrouped / reclassified / restated wherever considered necessary.
6) During the year company has issued the Bonus share in ratios of 2:3 as on 28th April, 2023. EPS of the respective period has been restated as per the Weighted Averages outstanding Balance of shares as per the Ind AS 33 "Earning Per Share".
7) The Company has single reportable business segment. Hence, no separate information for segment wise disclosure is given in accordance with the requirements of Indian Accounting Standard (Ind AS) 108 - "Operating Segments".
8) The Company has been migrated from the SME platform of BSE to Main board on 02nd June, 2023 and hence these results have been prepared by adopting the Indian Accounting Standards.
9) As required by para 32 of Ind AS 101, net profit reconciliation between the figures reported under the previous GAAP and IND-AS is as under.

Equity Reconciliation:

Particular	31-03-2022
Equity As Per IGAAP	1840.58
Add/(Less): Ind AS Adjustment	-
Impact of any Other Adjustments	-
Equity As Per Ind-AS	1840.58

Reconciliation Profit & Loss:-

Particular	For the Quarter Ended 31/03/2023	For the Year Ended 31/03/2023
Net Income/(loss) As Per IGAAP	110.55	170.02
Add/(Less): Ind AS Adjustment	-	-
Impact on Other Comprehensive Income	-	-
Net Income/(loss) As Per Ind-AS	110.55	170.02

FOR SPRAYKING LIMITED
(Formerly known as Sprayking Agro Equipment Limited)

Sd/-
Hitesh Dudhagara
Chairman & Director (DIN: 00414604)

Date: May 28, 2024
Place: Jamnagar

GLITTEK GRANITES LIMITED Registered Office: Plot No. 42, KIADB Industrial Area, Hoskote, Bangalore-562114. Phone: (080) 27815655/566, www.glittek.com. E-mail: info@glittek.com. CIN: L14102KA1990PLC023497

Notice of Postal Ballot: Notice is hereby given that pursuant to Section 108 and 110 of the Companies Act, 2013 (the "Act") read with Rule 20 and Rule 22 of Companies (Management & Administration) Rules, 2014, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), Secretarial Standard on General Meetings ("SS-2") issued by the Institute of Company Secretaries of India and other applicable provisions of the Act, Rules, Circulars and Notifications issued thereunder (including any statutory modifications or re-enactment thereof for the time being in force and as amended from time to time), for holding general meetings/conducting postal ballot process through e-Voting via General Circular bearing Nos. 14/2020 dated 08.04.2020, 17/2020 dated 13.04.2020, 20/2022 dated 05.05.2022, 22/2020 dated 15.06.2020, 33/2020 dated 28.09.2020, 39/2020 dated 31.12.2020, 10/2021 dated 23.06.2021, 20/2021 dated 08.12.2021, 21/2021 dated 14.12.2021, 3/2022 dated 05.05.2022, 11/2022 dated 28.12.2022 and 09/2023 dated 25/09/2023. Circular No. SEBI/HO/CFD/CMD2/ CIR/P/2022/262 dated 13.05.2022 and SEBI/HO/CFD/PO-2/P/2023/234 dated 05.01.2023 issued by the Securities and Exchange Board of India (SEBI) (collectively referred to as "the Circulars") to that the Resolutions as set out in this Notice are proposed for consideration by the Members of the Company for passing through Postal Ballot only by remote e-voting process ("e-voting") For:

Description of Special Resolution: 1. To approve the overall Borrowing Limits u/s 180(1)(c) of the Companies Act, 2013. 2. To seek approval under Section 185(1)(a) of the Companies Act, 2013 inter alia for sale, lease or disposal of, creation of mortgage or charge on all the assets (Fixed or current assets), properties or undertakings (if the Company) in compliance with the requirement of the Circulars, the Company will send Postal Ballot Notice by e-mail to all its members who have registered their e-mail addresses with the Company or Depository / Depository Participants and the communication of assent / dissent of the Members will take place through the remote e-Voting system. The physical Postal Ballot Notice along with Postal Ballot Form and prepaid business envelope will therefore not be sent to the Members for this Postal Ballot. The postal Ballot notice dated May 23rd, 2024 has been sent by e-mailed on Tuesday dated May 28th, 2024.
The Explanatory Statement pursuant to Section 102 of the Companies Act, 2013 and Regulation 17(11) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 pertaining to the said Resolutions, setting out material facts and the reason for the resolution is also annexed. You are requested to peruse the proposed resolution along with the Explanatory Statement and thereafter record your assent or dissent through Postal Ballot by remote e-Voting facility provided by the Company.
The Board of Directors at its meeting held on May 23, 2024, have appointed Mr. Abhijit Jain (Membership No. FCS 4975/CP No. 3426), Company Secretary in Practice to be the Scrutinizer for conducting the Postal Ballot voting process through electronic means in a fair and transparent manner.
In compliance with the provisions of Sections 108 and 110 of the Act read with Rule 20 and 22 of the Management Rules, Regulation 44 of the LODR Regulations, and SS-2, the Company has provided e-voting facility to its members to cast their votes electronically. The detailed procedure with respect to e-voting is mentioned in this Notice. The Company has engaged CDSL (Central Depository Services Ltd.) for facilitating e-voting.
Members desiring to exercise their votes are requested to carefully read the instructions indicated in this Notice and record their assent (FOR) or dissent (AGAINST) by following the procedure as stated in the Notice forming part of this Notice. The e-voting facility will be available and commence on Wednesday at 9.00 a.m. IST on May 29, 2024 and concludes on Thursday 5.00 p.m. IST on June, 27th, 2024. Cut-off date for eligibility to vote is May 24th, 2024.
The e-voting facility will be disabled by CDSL, immediately after 5.00 p.m. IST on June 27, 2024. The Scrutinizer will submit his report to the Chairman of the Company, or any person authorised by him, after completion of the scrutiny. The results of the Postal Ballot along with the Scrutinizer's Report will be posted on the Company's website www.glittek.com and will be intimated to the Stock Exchanges where the shares of the Company are listed. The Resolutions, if passed by requisite majority shall be deemed to have been passed on June 27, 2024 being the last date specified by the Company for e-Voting.
Any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, may be refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com or contact Mr. Mohy Biswas, Regional Manager, Kolkata at Phone (033) 2282-1376 or e-mail: helpdesk.evoting@cslindia.com or mohy@cdslindia.com, under help section.
Place: Bangalore
Date: May 28th, 2024

For Glittek Granites Limited
Sd/- Lata Bagri, Company Secretary & Compliance Officer

NAVI MUMBAI INTERNATIONAL AIRPORT

NOTICE INVITING EXPRESSION OF INTEREST FOR GROUND POWER UNITS (GPU) & PRE-CONDITIONED UNITS (PCA) AT NMIA

Navi Mumbai International Airport Private Limited ("NMIAL") has been granted the right to develop, operate and maintain the Navi Mumbai International Airport ("NMIA") on DBFO basis. As a part of project development at NMIA, NMIAL proposes to undertake the award of Ground Power Units (GPU) & Pre-Conditioned Units (PCA) Tender.

The scope of works for each of the above work includes but will not be limited to Supply, installation, integration, interfacing, testing, commissioning, operation trials, obtaining all requisite statutory approvals / licenses, warranty support, rectification of defects, obligations during Warranty Period/ defect rectification period, supply of spares and special tools, providing labour, material, equipment and services of GPU & PCA Works and shall include all works including related, associated and temporary works as may be required.

NMIAL invites responses to the Expression of Interest ("EOI") from qualified, experienced and reputed contractors in each of these categories.

Interested applicants may download and submit their response to the EOI by registering on the NMIAL e-tender portal: <https://nmiairport.abcpocure.com>. Applicants are required to submit the response under the corresponding Event IDs, depending upon the category they chose to apply for. For further details and instructions, please visit the E-tenders section of our website: www.nmiairport.co.in.

The deadline for submission of the response to EOI is **12th June, 2024, 15:00 hrs IST.**

Note: NMIAL reserves the right to reject any response to EOI or change / cancel the tender process at any time without prior notice or without assigning any reason whatsoever.

NAVI MUMBAI INTERNATIONAL AIRPORT PVT. LTD.

Email: anand.chadrakhar@adani.com & nmiair.tenders2@adani.com
Website: www.nmiairport.co.in

"IMPORTANT"

Whilst

